

17 એપ્રિલ 2018

**બ્રેમ્પટન પોતાના કાન ભોંય પર ખુલ્લા રાખી ભવિષ્ય માટે સતર્ક છે:
નોર્થવેસ્ટ GTA માં મ્યુઝિક ક્ષેત્રે સર્વોત્તમ હોય તેને NXNE ખાતે નિગાહમાં લાવવામાં આવશે**

સંગીતના તમામ ઉગતા કલાકારોને હાકલ કરવામાં આવે છે કે તેઓ 'થિસ ઈઝ બ્રેમ્પટન'ને નિગાહ હેઠળ લાવવામાં મદદરૂપ થાય, શોકેસ અંતિમ તારીખ એપ્રિલ 27ના રોજ લાગુ

બ્રામ્પટન, ઓન્ટેરિયો – એલેસિયા કારાની ગ્રેમી જીત પછી તરત, જેસિ રેયેઝનો JUNO અવોર્ડ, અને બ્રેમ્પટન આર્ટ્સ વોક ઓફ ફેમના નોંધપાત્ર કલાકારો એગઝકો લેવિ અને હોટલાઈન બિલ્ગનું ડાયરેક્ટર એક્સનું ઈન્ડક્શન થયું અને બ્રેમ્પટન વૈશ્વિક સંગીત ક્ષેત્રે આગળ ધપવાનું ચાલુ રાખે છે જે ઉગતા કલાકારોનું જન્મસ્થળ હોવાનું પુરવાર થાય છે. આજરોજ સીટી ઓફ બ્રેમ્પટને જાહેર કર્યું કે તે વિશ્વના અગ્ર મ્યુઝિક ફેસ્ટિવલમાં સહભાગી થાય છે, નોર્થ બાય નોર્થવેસ્ટ (NXNE) જે પહેલવહેલી એવી ભાગીદારી છે જ્યાં બ્રેમ્પટનને જેમણે પોતાનું વતન બનાવ્યું છે એવા જોરદાર અને નવોદિત કલાકારો પર પ્રકાશ ફેંકાશે.

થિસ ઈઝ બ્રેમ્પટન NXNEના ભાગરૂપે જુન 15 અને શુક્રવારના રોજ રિવોલી (334, ક્વિન સ્ટ્રીટ, ડબલ્યુ, ટોરોન્ટો) ખાતેના આઈકોનિક લાઈવ મ્યુઝિક વેન્યુ પર ધમાલ મચાવશે. આ ઉત્તેજનાપૂર્ણ કાર્યક્રમમાં સહભાગી થઈ બ્રેમ્પટનના ગૌરવની ઉજવણીમાં જોડાઈ જવ, સીટી ઓફ બ્રેમ્પટન તમામ સ્થાનિક સંગીતકારો, રેકોર્ડિંગ આર્ટિસ્ટો અને બેન્ડ્સને બોલાવી રહ્યા છે જેથી તેમને મૂલ્યવાન એક્સ્પોઝરની તક મળે જે તેમની મ્યુઝિકની કારકિર્દીઓને આગળના સ્તરે લઈ જવામાં મદદરૂપ થઈ શકે.

કેવી રીતે સહભાગી થવું: તમામ જાનરના (genres) રેકોર્ડિંગ આર્ટિસ્ટો અને બેન્ડ્સને culture@brampton.ca પર અરજીઓ કરવાનું આમંત્રણ છે જે એપ્રિલ 27 સાંજે 4 ET કરતા મોડું ન હોય. GTAના મ્યુઝિક ટેસ્ટમેકરો (એવા લોકો જેઓ વેબ-આધારિત પ્લેટફોર્મ ચલાવે છે જ્યાં તેમની રુચિ અથવા ચોક્કસ શૈલીના સંગીતનો સંગ્રહ થાય છે) રજૂઆતોને ક્યુરેટ કરશે (એટલેકે પ્રસ્તૂતિકરણના સંદર્ભમાં યોગ્ય કલાકારો પસંદ કરશે અને ગોઠવશે); માત્ર સફળ અરજદારોનો સંપર્ક મે માસના મધ્યમાં કરાશે.

અરજી માટેના દિશાનિર્દેશો સહિત *થિસ ઈઝ બ્રેમ્પટન* વિશે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો: www.brampton.ca/NXNE અથવા અહીં ઈમેલ કરો culture@brampton.ca.

GTAમાં સૌથી યુવાન અને અનન્યપણે વૈવિધ્ય ધરાવતા શહેર તરીકે બ્રેમ્પટન એક સાચા સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે જે વિશ્વની સૌથી સર્જનાત્મક અને પ્રમાણસિદ્ધ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરે છે.

થિસ ઈઝ બ્રેમ્પટન, NXNEની ટેસ્ટમેકર સિરિઝ 2018નું એક ફિચર હશે, જે કેનેડાની મ્યુઝિક ક્ષેત્રની હસ્તીઓ, ડિજિટલ ઇન્ફલુએન્સરો, ઉદ્યોગનાં અગ્રણીઓ, પ્રાંતીય, શહેરના અને રાષ્ટ્રીય અસોસિએશનો, ઉદ્યોગનાં અસોસિએશનો, રેકોર્ડના લેબલો તેમજ બીજા ઘણાં બધાં દ્વારા પ્રોગ્રામ કરવામાં આવનાર કાર્યક્રમોનો સેટ છે.

શોકેસ માટે ટિકિટો અને રિસ્ટબેન્ડ્સ અહીં ઉપલબ્ધ છે nxne.com.

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca